

ડિસેમ્બર 4, 2018

રોઈના સાન્ટોસની નિમણૂક વધારાના રીજીયનલ કાઉન્સિલર તરીકે કરવામાં આવી

બ્રામ્પટન, ઓન્ટેરિયો – આજે યોજાયેલી ખાસ બેઠકમાં, બ્રામ્પટન સીટી કાઉન્સિલે ઓફિસના 2018-2022 સુધીના સમયગાળા માટે પીલ રીજીયનલ કાઉન્સિલ પર બ્રામ્પટનના વધારાના રીજીયનલ કાઉન્સિલર તરીકે સેવા આપવા સીટી કાઉન્સિલર રોઈના સાન્ટોસ (વોર્ડ્સ 1 અને 5) ની નિમણૂક કરી.

કાઉન્સિલર રોઈના સાન્ટોસ ડિસેમ્બર 6, 2018 નાં રોજ પીલ રીજીયનલ કાઉન્સિલની ઉદ્ઘાટન બેઠકમાં રીજીયનલ કાઉન્સિલર તરીકે ઓફિસના સોગંદ લેશે.

વર્ષ 2005 માં, પ્રાંતીય સરકારે બિલ (વિધેયક) 186 રજૂ કર્યું, જેનાથી પીલ કાઉન્સિલમાં બ્રામ્પટનનું પ્રતિનિધિત્વ એક સભ્ય (મેયર, પાંચ રીજીયનલ કાઉન્સિલર્સ, વત્તા એક વધારાના કાઉન્સિલર) થી વધ્યું. વધારાના રીજીયનલ કાઉન્સિલરની નિમણૂક સીટી કાઉન્સિલ દ્વારા મ્યુનિસિપલ ચૂંટણી પછી પાંચ ચૂંટાયેલા સીટી કાઉન્સિલર્સમાંથી થાય છે. તે વ્યક્તિ ત્યાર પછી સીટી અને રીજીયનલ કાઉન્સિલના સભ્ય તરીકે બેસશે.

સીટી કાઉન્સિલે કાઉન્સિલના પૂરા સમયગાળા માટે નહિ પરંતુ તેને બદલે કાઉન્સિલ ઓફિસના સમયગાળામાં વારાફરતી (અથવા આવા અન્ય) ધોરણે વધારાના રીજીયનલ કાઉન્સિલરના પદની નિમણૂક કરવાની છૂટ આપવા કર્મચારીગણને અન્ય સંભવિત તકો શોધી કાઢવાની વિનંતી પણ કરી જેથી એક કરતા વધારે સીટી કાઉન્સિલરને વધારાના રીજીયનલ કાઉન્સિલરની ભૂમિકા ભજવવાની પરવાનગી આપવાનો હેતુ સિદ્ધ થાય.

ઉપરાંત, સીટી કાઉન્સિલે 2018-2022 નાં સમયગાળા માટે પીલ રીજીયનલ કાઉન્સિલમાં બ્રામ્પટન રીજીયનલ કાઉન્સિલર હંગામી ધોરણે ગેરહાજર રહેવાના કિસ્સામાં વૈકલ્પિક રીજીયનલ કાઉન્સિલર તરીકે સીટી કાઉન્સિલર હરકિરત સિંહની નિમણૂક કરી.

અવતરણો (ક્વોટ્સ):

“બહુ ઝડપથી વિકસી રહેલા શહેર તરીકે, બ્રામ્પટને પીલ રીજીયનલ કાઉન્સિલમાં એક મહત્વની ભૂમિકા ભજવવાની રહે છે. આ પ્રદેશમાં સુદૃઢ ઉપસ્થિતિ વડે, બ્રામ્પટન સામુદાયિક પોલીસ કામગીરી અને સુરક્ષા, સસ્તા આવાસો અને નોકરી સર્જન જેવા આપણાં શહેર માટે સટીક મુદ્દાઓ પર પ્રાદેશિક અર્થવ્યવસ્થાના ભવિષ્યને આકાર આપવામાં મદદરૂપ થશે. આ વધારાના સખત અવાજ વડે, હું માનું છું કે કાઉન્સિલર સાન્ટોસનો બહોળો નીતિગત અનુભવ અને બ્રામ્પટનની મહત્વની કાર્યનીતિ જરૂરિયાતોની સમજથી બ્રામ્પટનના રહેવાસીઓ માટે આપણી ટીમના લક્ષ્યોને ટેકો મળશે. હું ખાસ કરીને એ વાતનું ગૌરવ ધરાવું છું કે તેણી બ્રામ્પટન સીટી કાઉન્સિલમાં ચૂંટાયેલી પહેલી ફિલિપિનો કેનેડિયન છે.”

- મેયર પેટ્રિક બ્રાઉન

“હું રીજીયનલ કાઉન્સિલર તરીકે નિમણૂક મેળવીને સન્માનિત અનુભવું છું અને બ્રામ્પટનના હિતો માટે વકાલત કરવા આશાવાદી છું. સામાજિક, આવાસીય, પોલીસ અને તબીબી સેવાઓ, પાણી અને કચરો વ્યવસ્થાપન કાર્યક્રમો સહિતની પ્રાદેશિક જવાબદારીઓની અસર જીવનની ગુણવત્તા પર પડે છે અને હું આપણાં રહેવાસીઓનો અવાજ સાંભળવામાં આવે તે ખાતરી કરાવવા કટિબદ્ધ છું.”

- રીજીયનલ કાઉન્સિલર રોઈના સાન્ટોસ

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં

વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ

સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન | સીટી ઓફ બ્રામ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca